


Guia de instalação da unidade principal Ana Birim Kurulum Kılavuzu Οδηγός εγκατάστασης κύριας μονάδας

BDV-L800/BDV-L800M/BDV-L600




©2011 Sony Corporation

EEE Yönetmeliğine Uygundur



Para instalar a unidade principal horizontalmente, consulte as instruções abaixo. / Ana birimi yatay konumda takmak için aşağıdaki talimatlara bakın. / Για την εγκατάσταση της κύριας μονάδας σε οριζόντια θέση, ανατρέξτε στις παρακάτω οδηγίες.



Para instalar a unidade principal numa parede, consulte as instruções no verso. / Ana birimi duvara takmak için arka sayfadaki talimatlara bakın. / Για την εγκατάσταση της κύριας μονάδας σε τοίχο, ανατρέξτε στις οδηγίες στην πίσω σελίδα.



- Antes de instalar a unidade principal numa posição horizontal ou numa parede, ligue todos os cabos, etc. à unidade principal consultando as instruções de funcionamento.
- Coloque um pano no chão para evitar danificar o chão durante a instalação da unidade principal.
- A Sony não é responsável por acidentes ou danos causados por uma instalação inadequada, pela pouca resistência da parede, por uma fixação incorrecta dos parafusos, por calamidades naturais, etc.

- Ana birimi yatay bir konumda veya duvara monte etmeden önce, Kullanım Talimatları'na bakarak tüm kabloları ana birime bağlayın.
- Ana birimi takarken zeminin zarar görmesini önlemek için yere bir örtü serin.
- Hatalı kurulum, duvarın yeterince dayanıklı olmaması, hatalı vida takılması veya doğal afet gibi nedenlerle oluşan kaza veya hasarlardan Sony sorumlu tutulamaz.

- Πριν να εγκαταστήσετε την κύρια μονάδα σε οριζόντια θέση ή σε τοίχο, συνδέστε όλα τα καλώδια κ.τ.λ. στην κύρια μονάδα, ανατρέχοντας στις Οδηγίες χρήσης.
- Απλώστε ένα ύφασμα στο δάπεδο, για να αποφύγετε την πρόκληση φθοράς κατά την εγκατάσταση της κύριας μονάδας.
- Η Sony δεν είναι υπεύθυνη για ατυχήματα ή ζημιές που προκαλούνται από ακατάλληλη εγκατάσταση, ανεπαρκή ανθεκτικότητα του τοίχου ή ακατάλληλη εγκατάσταση των βιδών, φυσικές καταστροφές κ.τ.λ.


Numa posição horizontal / Yatay konumda / Σε οριζόντια θέση

Item necessário / Gerekli Malzeme / Απαραίτητο είδος


- A**  Tampa do suporte / Stant kapağı / Κάλυμμα βάσης


Instalação / Kurulum / Εγκατάσταση

1




2


 : Utilize esta marca para identificar a orientação no suporte (C). / Standin yönünü belirlemek için bu işareti kullanın (C). / Χρησιμοποιήστε αυτή την ένδειξη, για να προσδιορίσετε τον προσανατολισμό της βάσης (C).




3




4



5




6




Numa parede / Duvara / Σε τοίχο

Itens necessários / Gerekli Malzemeler / Απαραίτητα είδη



300 g (11 oz)


Suporte de montagem na parede A* /
Duvara montaj desteği A* /
Βραχίονας ανάρτησης σε τοίχο A*



40 g (1.4 oz)

Suporte de montagem na parede B* /
Duvara montaj desteği B* /
Βραχίονας ανάρτησης σε τοίχο B*

*Os suportes de montagem na parede A e B não são fornecidos em algumas áreas. / *Duvara montaj desteği (A ve B) bazı bölgelerde ürünle birlikte verilmemektedir. / *Οι βραχίονες ανάρτησης σε τοίχο A και B δεν παρέχονται σε ορισμένες περιοχές.



Nove parafusos (não fornecidos) /
Dokuz adet vida (ürünle birlikte verilmez) /
Εννέα βίδες (δεν παρέχονται)




- Contacte uma serralharia ou um instalador para mais informações sobre o material de construção da parede e os parafusos a utilizar.
- Utilize parafusos adequados ao material de construção e à resistência da parede. Uma parede com estuque é particularmente frágil, pelo que deve fixar os parafusos a uma trave e depois à parede. Instale a unidade principal numa parede vertical e lisa, onde seja aplicado um reforço. (Peso (aprox.) da unidade principal: BDV-L800: 3,2 kg, BDV-L800M: 3,3 kg, BDV-L600: 3,0 kg)

- Duvarın yapıldığı malzemeyle veya kullanılması gereken vidalarla ilgili olarak bir nalbura veya montaj uzmanına danışın.
- Duvarın yapıldığı malzemeye ve duvarın dayanıklılığına uygun vidalar kullanın. Alçı levha duvarlar çok kırılğan olduğundan, vidaları bir kirişe sağlam şekilde tutturarak duvara sabitleyin. Ana birimi dikey ve düz bir duvardaki güçlendirilmiş bir yere takın. (Ana birimin ağırlığı (yaklaşık): BDV-L800: 3,2 kg (7 lb 1 oz), BDV-L800M: 3,3 kg (7 lb 5 oz), BDV-L600: 3,0 kg (6 lb 10 oz))


Instalação / Kurulum / Εγκατάσταση

1




2


Disponha o cabo de alimentação CA e os outros cabos de acordo com o seu ambiente. / AC güç kablosunu (şebeke kablosu) ve diğer kabloları kurulum şartlarının ortama uygun şekilde düzenleyin. / Τακτοποιήστε το καλώδιο ρεύματος (καλώδιο σύνδεσης με το δίκτυο ρεύματος) και τα άλλα καλώδια, έτσι ώστε να ταιριάζουν με το περιβάλλον σας.



3




Para passar os cabos pela esquerda. /
Kabloları sol tarafta düzenlemek için. /
Τοποθέτηση των καλωδίων προς τα αριστερά.




4


Instale o suporte de montagem na parede A numa parede. /
Duvara montaj desteği A'yi duvara takın. / Εγκαταστήστε τον βραχίονα ανάρτησης A σε τοίχο.



Deixe espaço suficiente em redor da abertura (A):
125 mm acima, 105 mm abaixo, 240 mm à esquerda
e 240 mm à direita (lado da ranhura para discos). /
(A) açıklığının çevresinde yeterli boşluk bırakın: yukarıda
125 mm (5 inç), aşağıda 105 mm (4 1/4 inç), solda 240 mm
(9 1/2 inç) sağda (disk yuvasının bulunduğu taraf) 240 mm
(9 1/2 inç). / Αφήστε επαρκή χώρο γύρω από το
άνοιγμα (A): 125 mm (5 ίντσες) πάνω, 105 mm
(4 1/4 ίντσες) κάτω, 240 mm (9 1/2 ίντσες) αριστερά και 240 mm
(9 1/2 ίντσες) δεξιά (πλευρά υποδοχής του δίσκου).



5



Faça deslizar a unidade principal para baixo até (B) encaixar,
emitindo um estalido. / Ana birimi, (B) tıklama sesi çıkarana
kadar aşağıya doğru kaydırın. / Σύρετε την κύρια μονάδα
προς τα κάτω μέχρι το (B) να ασφαλίσει στη θέση του με
ένα κλικ.

Para remover a unidade principal da parede. /
Ana birimi duvardan sökmek için. /
Αφαίρεση της κύριας μονάδας από τον τοίχο.

